

સામાન્ય જ્ઞાન કસોટી ભાગ- ૯

- 1.બ્રહ્મા - નારદ નું વિરલ મૂર્તિસ્થળ કામરેજ ક્યા જીલ્લામાં આવેલું છે. (ASW-2018)
(A)નર્મદા (B)ભરૂચ (C)સુરત (D)તાપી
- 2.ગુજરાતમાં ખનીજ ઉત્પાદન બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ? (GPSC-2021)
1. ગુજરાત એ દેશમાં બીજા ક્રમનું સૌથી મોટું બ્રાઉન ગોલ્ડ ઉત્પાદક રાજ્ય છે.
2. ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા એ બોક્સાઈટનો સમૃદ્ધ સ્ત્રોત છે.
3.ગુજરાતમાં મેગેનીઝની કોઈ ખાણ મળી આવી નથી.
4. છોટાઉદેપુર ખાતે ફ્લોરસ્પારની ખાણ જોવા મળે છે.
(A)1,2,3અને 4 (B)માત્ર 1, 3અને 4 (C)માત્ર1,2અને 4 (D)માત્ર 2અને 4
- 3.'ભવાની મંદિર' નામની પુસ્તિકામાંએ સશસ્ત્ર ક્રાંતિની યોજના આલેખી છે ? (GPSC-2020)
(A)ચંદ્રશેખર આઝાદ (B)અરવિંદ ઘોષ (C)લાલા લજપતરાય (D)સુભાષચંદ્ર બોઝ
- 4.જીવન સંસર્ગથી ગાંધીજીના જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક વ્યક્તિનું નામ જણાવો. (GSSSB-2021)
(A)રેવાશંકર (B)જગજીવન (C)રાયચંદભાઈ (D)મુક્તાનંદજી
- 5.'શરીરના સંવેદનશીલ ભાગ'- શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
(A)સંવેદનસ્થાન (B)સંવેદનશીલ (C)મર્મદાયક (D)મર્મસ્થાન
- 6.નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો.- 'તરોપો'
(A)હોડી (B)નારિયેળ (C)ઠીંકડું (D)તરાપો
- 7.ગુજરાતનાં જંગલો અને સ્થળને ગોઠવો. (GSRTC-2019)
(1) જાંબુઘોડા (a) અમરેલી
(2) હિંગોળગઢ (b) પંચમહાલ
(3) ખીજડીયા (c)રાજકોટ
(4) પાનીયા (d) જામનગર
(A)(1)- (b), (2) - (c), (3) - (d), (4) - (a)
(B) (1)- (c), (2) - (d), (3) - (a), (4) - (b)
(C) (1)- (d), (2) - (a), (3) - (b), (4) - (c)
(D) (1)- (a), (2) - (b), (3) - (c), (4) - (d)
- 8.ગુજરાતની બાબતમાં નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? (GPSC-2020)
i. રાજ્યની આબોહવાકીય પરિસ્થિતિ ઉષ્ણ કટિબંધીય છે.
ii. રાજ્યનો મહત્તમ વિસ્તાર (31%) ઉત્તર ગુજરાત ક્ષેત્રનો શુષ્ક ઝોન છે.
iii. દક્ષિણ ગુજરાતનો ભારે વરસાદી ઝોન સૌથી ઓછો વિસ્તાર છે.
(A)ફક્ત i અનેii (B)ફક્ત i અનેiii (C)ફક્ત ii અનેiii (D)ફક્ત i,ii અને iii

9.મહાભારતના પરિશીલનના પરિપાકરૂપે પ્રાપ્ત થતો અભ્યાસગ્રંથ ' કૃષ્ણ અને માનવ સંબંધો' ના લેખકનું નામ જણાવો. (GSSSB-2016)

(A)કનૈયાલાલ મુનશી (B)હરિન્દ્ર દવે (C)ગો.મા. ત્રિપાઠી (D)ગુણવંત આચાર્ય

10.સાહિત્યકાર અશોક ચાવડાનું ઉપનામ (તખલ્લુસ) જણાવો.

(A)બેદિલ (B)બેકાર (C)અનન્ય (D)બેનામ

11.જીભ આવી હોય તો કયું વિટામિન લેવું પડે ? (GSSSB -2012)

(A)વિટામિન -B (B)વિટામિન -C (C)વિટામિન -A (D)વિટામિન -D

12.નીચે લેખક અને તેમના દ્વારા રચિત કૃતિ દર્શાવી છે, તેમની યોગ્ય જોડનો સાચો ક્રમ કયો થશે ?

1. પ. આનંદશંકર ધ્રુવ અ. વિભૂતિ પ્રાર્થના
2. રમણભાઈ નીલકંઠ બ. બુદ્ધ ચરિત
3. નરસિંહરાવ દિવેદિયા ક. હિન્દુ ધર્મની બાળપોથી
4. નાનાલાલ ડ. કૃષ્ણાવતાર
(A) 1 -બ, 2 - ડ, 3 - ક, 4 - અ (B) 1 -ડ, 2 - બ, 3 - અ, 4 - ક
(C) 1 -ડ, 2 - બ, 3 - ક, 4 - અ (D) 1 -અ, 2 - ડ, 3 - ક, 4 - બ

13.ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં ધાર્મિક એકતા અને અસ્પૃશ્યતાના નિવારણની આલબેલ પોકારતી પલ્લીના ઉત્સવની વિધિ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?

i.દલિતો શમી વૃક્ષનું લાકડું લાવે છે.
ii. સુથાર તેમાંથી પલ્લી (લાકડાનો રથ) બનાવે છે.
iii. લુહાર માતાનું છત્ર બનાવે છે.
iv. વહોરાઓ ફૂડામાં કપાસિયા પૂરે છે.
(A)ફક્ત i અનેii (B)ફક્તii,iiiઅનેiv (C)ફક્ત i,ii,iiiઅનેiv (D)ફક્ત i,ii અને iii

14.ભગવાન ધર્મનાથની પવિત્ર મૂર્તિ ધરાવતું સ્થળ પાનસર કયા જિલ્લામાં આવેલું છે ?(ASW-2018)

(A)ગાંધીનગર (B)અમદાવાદ (C)મહેસાણા (D)પાટણ

15.અલાઉદ્દીન ખીલજીની ગુજરાત પરની ચઢાઈનું વર્ણન કરતો ગુજરાતી ગ્રંથ કયો છે ?

(A)ગુજરાતનો ઇતિહાસ (B)કાન્હદે પ્રબંધ (C)ત્રિભુવનદીપક પ્રબંધ (D)કરણઘેલો

16.AMULનું આખું નામ શું છે ? (GSRTC-2019)

(A)આણંદ મિલ્ક યુનાઈટેડ લિમિટેડ (B)આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ
(C)ઓલ મિલ્ક યુનિયન લિમિટેડ (D)ઓલ મિલ્ક યુનાઈટેડ લિમિટેડ

17.ગુજરાતમાં સૌપ્રથમ તોપનો ઉપયોગ કરનાર સુલતાન કોણ હતો ?

(A)કુમારપાળ દેસાઈ (B)મહમદ બેગડો (C)સિદ્ધરાજ જયસિંહ (D)વસ્તુપાળ

18. ગુજરાતી કવિ ઉમાશંકર જોશીએ ‘ વિશાળ જગ વિસ્તારે....’ કોના દ્વારા શાનો સંદેશો આપ્યો છે ?
 (A) માનવતાનો (B) વિશ્વશાંતિનો (C) પશુપ્રેમનો (D) પર્યાવરણનો
19. ઝવેરચંદ મેઘાણીના ક્યા કાવ્યસંગ્રહમાંથી જાણીતી કવિતા ‘ ચારણ કન્યા’ લેવામાં આવી છે ?
 (A) કંકાવટી (B) રઢિયાળી રાત (C) વેણીના ફૂલ (D) યુંદડી
20. કચ્છ જિલ્લામાં આવેલ પાંધ્રો વિસ્તારમાંથી શું મળી આવે છે ?
 (A) લિઝ્નાઈટ કોલસો (B) અશુદ્ધ લોખંડ (C) જીપ્સમ (D) ડાયનાસોરના અવશેષો
22. પ્રેમાનંદની મહેતાગીરી કરનાર વણિક કવિ કોણ હતા ?
 (A) કાલિદાસ (B) હરિદાસ (C) ચેતનદાસ (D) મેઘદાસ
23. GDPનું આખું જણાવો. (GSRTC-2019)
 (A) Global Development Point (B) Gross Domestic Product
 (C) General Development Product (D) Gross Development Point
24. પશ્ચિમ તરફ વહેતી નદીઓની લંબાઈના ચઢતા ક્રમમાં નીચેના પૈકી કયું સાચું છે ?(GPSC-2021)
 (A) નર્મદા- તાપી- સાબરમતી- મહી (B) તાપી - નર્મદા - મહી- સાબરમતી
 (C) સાબરમતી- નર્મદા- તાપી- મહી (D) સાબરમતી- મહી- તાપી- નર્મદા
25. “હું ફૂટપાથ પરનો થાક, ખેતરમાં જઈને ઉતારું છું”- આ પંક્તિ ક્યા કવિની છે ?
 (A) રઘુવીર ચૌધરી (B) મકરંદ દવે (C) ઉમાશંકર જોશી (D) રાવજી પટેલ
26. નરસિંહ મહેતાનો પ્રિય છંદ કયો છે ?
 (A) શાદૂલવિકડિત (B) પૃથ્વી (C) ઝૂલણા (D) ચોપાઈ
27. ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ?
 (A) લક્ષ્મીમલ સિંઘવી (B) મહાત્મા ગાંધી (C) જયપ્રકાશ નારાયણ (D) બી.આર.આંબેડકર
28. ક્યા કવિએ પાક લણવાની ઋતુને ‘ મહેનતની મોસમ’ કહી છે ?
 (A) ધીરૂભાઈ પરીખ (B) રાજેન્દ્ર શાહ (C) નાથાલાલ દવે (D) હરિન્દ્ર દવે
29. મંગળ ગ્રહ બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચા છે ? (GPSC-2020)
 i. મંગળનું વાતાવરણ મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઈડ અને થોડીક પાણીની બાષ્પનું બનેલું છે.
 ii. મંગળને બે ચંદ્રો છે.
 iii. આ ગ્રહ એ પૃથ્વીથી નજીકના ગ્રહોમાં ચોથા ક્રમે આવે છે.
 (A) ફક્ત i અને ii (B) ફક્ત i અને iii (C) ફક્ત ii અને iii (D) ફક્ત i, ii અને iii
30. ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્ઘાટન કોના દ્વારા થયું હતું ?
 (A) સુશ્રી શારદા મુખરજી (B) ડૉ. જીવરાજ મહેતા (C) રવિશંકર મહારાજ (D) ઉછંગરાય ઢેબર
31. આઝાદી માટેના સંગ્રામ સમયે અમદાવાદમાં મિલમજૂરોની માગણી બાબતની હડતાળ સમયે મજૂરો સામે મક્કમ રહેવામાં કોણ અગ્રેસર હતું ?(ASW-2018)
 (A) અનસૂયાબેન (B) શેઠ અંબાલાલ (C) શેઠ મગનલાલ (D) દમયંતિબેન શેઠ

32. “તમે મારા દેવના દીઘેલ છો, તમે મારા માગી લીઘેલ છો, આવ્યા છો ત્યારે અમર થઈને રહો.” – આ ગુજરાતી લોકગીત કયા પ્રકારનું છે ?
- (A) લગ્નગીત (B) બાળગીત (C) વ્રતગીત (D) હાલરડું
33. સૌરમંડળનો કયો ગ્રહ પશ્ચિમમાં સૂર્યોદય અનુભવે છે ? (GPSC-2020)
- (A) મંગળ (B) બુધ (C) શુક્ર (D) ગુરુ
34. કઈ સમિતિની ભલામણથી PESA (Panchayat Enlarged Scheduled Areal) Act અમલમાં લાવવામાં આવ્યો ?
- (A) અશોકમહેતા સમિતિ (B) બળવંતરાય મહેતા સમિતિ
(C) જી.કે.રાવ સમિતિ (D) દિલીપસિંહ ભૂરીયા સમિતિ
35. મહુવા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે ?
- (A) સુરત (B) ભાવનગર (C) ખેડા (D) A અને B
36. આકાશગંગાના આવેલા સફેદ અને કાળા વાયુ-વાદળોને શું કહે છે ?
- (A) નિહારિકા (B) પ્રકાશ વાદળો (C) ઉલ્કાઓ (D) ધૂમકેતુ
37. મેઘરાજાની છડીનો ઉત્સવ મેળો ખાતે ઉજવાય છે. (GPSC-2020)
- (A) ભરૂચ (B) ડાંગ (C) વલસાડ (D) ઉત્તરસંડા
38. ‘ગ્રામસભા જ ગામની લોકશાહી’- આ ઉક્તિ કોની છે ?
- (A) જવાહરલાલ નહેરૂ (B) મહાત્મા ગાંધીજી (C) બળવંતરાય મહેતા (D) જયપ્રકાશ નારાયણ
39. ભારતની સૌપ્રથમ સ્વદેશી બનાવટની સ્ટેન્ડિંગ વ્હીલ ચેર (Standing Wheelchair) કોના દ્વારા વિકસાવવામાં આવી છે.? (GPSC-2020)
- (A) IIT હૈદરાબાદ (B) IIT મદ્રાસ (C) IIT ગુવાહાટી (D) IIT ખડગપુર
40. નીચે દર્શાવેલ નિબંધ સંગ્રહના લેખકનું નામ જણાવો. (GSSSB-2012)
- મોજાંને ચીંધવા સહેલા નથી.
- (A) સુરેશ જોશી (B) પ્રિયકાન્ત મણિયાર (C) સુરેશ દલાલ (D) રઘુવીર ચૌધરી
41. નીચેનામાંથી કયો ઉપમા અલંકાર નથી તે ઓળખાવો.
- (A) ‘રૂપે અરૂણ ઉદય સરખો’
(B) ‘કાળજે ઊંડા કળણ છે, છદ્મ જેવી જિંદગી’
(C) ‘મા તે મા, બીજા બધા વનવગડાના વા’
(D) ‘ગુલછડી સમોવડી તે બાલિકા હતી’
42. દિલ્લી સલ્તનતમા શાસન કરનાર વંશોમાં સૌપ્રથમ કયા વંશે શાસન કર્યું હતું ?
- (A) તુગલક વંશ (B) સૈયદ વંશ (C) ખલજી વંશ (D) ગુલામવંશ
43. ગુજરાતના “ ગારૂડી” લોક સમુદાય બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચા છે ? (GPSC-2020)
- i. આ સમુદાયના લોકો ગરૂદ પક્ષી પકડવાના કસબના કારણે જાણીતા છે.

- ii. આ સમુદાય ના કેટલાક લોકોના વ્યવસાય રાવણહઠ્ઠા ઉપર ગીત ગાઈ ભિક્ષા માંગવાનો છે.
iii. આ સમુદાયનો પેટા સમુદાય, નાગમંદ્રા, નાગના બારોટ મનાય છે.

(A) ફક્ત i અને ii (B) ફક્ત i અને iii (C) ફક્ત ii અને iii (D) ફક્ત i, ii અને iii

44. પાણીપતનું પ્રથમ યુદ્ધ કઈ સલમા થયું હતું ?

(A) ઇ.સ. 1506માં (B) ઇ.સ. 1526માં (C) ઇ.સ. 1556માં (D) ઇ.સ. 1536માં

45. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિ તરીકેની ફરજો કોણ નિભાવે છે ?

(A) સ્પીકર (B) વડાપ્રધાન
(C) સુપ્રિમકોર્ટના ચીફ જસ્ટીસ (D) સોલિસિટર જનરલ

46. “બોલે મોર મહાતૂરો, હોયે ખાટી છાશ, પડે મેઘ મહી ઉપરે, રાખો રૂડા આશ.” કોનું ઉદાહરણ છે. (GPSC-21)

(A) છપ્પા (B) ભડલી વાક્ય (C) ચાબખા (D) લગ્નગીત

47. ‘ઢાઈ દિનકા ઝોપડા’ નામની મસ્જિદ કયા શહેરમાં આવેલી છે ?

(A) જયપુરમાં (B) અજમેરમાં (C) દિલ્લીમાં (D) ભોપાલમાં

49. સાહિત્ય અને કલાના ઉત્તેજનના કારણે કૃષ્ણદેવરાય કયા નામે ઓળખાયા ?

(A) આંધ્રના ભોજ (B) દક્ષિણના ભોજ (C) વિજયનગરના ભોજ (D) કર્ણાટકના ભોજ

50. ભગવાન મલ્લિનાથનું પવિત્ર યાત્રાસ્થળ ભોયણી કયા જીલ્લામાં આવેલું છે ? (ASW-2018)

(A) ગાંધીનગર (B) અમદાવાદ (C) મહેસાણા (D) પાટણ